

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.

બેચલર ઓફ આર્ટસ

સેમેસ્ટર-૪

વિષય: અર્થશાસ્ત્ર

Minor ૧ MAJOR પેપર-૮ : જાહેર વિત્તવ્યવસ્થા

અભ્યાસક્રમ

(વર્ષ: ૨૦૨૪-૨૫ થી NEP-2020 પ્રમાણે અમલમાં)

કેડીટ-૪

અભ્યાસક્રમના ઉદ્દેશ્યો:

જાહેર અર્થશાસ્ત્ર એ આર્થિક કાર્યક્ષમતા અને સમાનતાના દૃષ્ટિકોણથી સરકારી નીતિનો અભ્યાસ છે. આ અભ્યાસક્રમ અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણી અને આવકના વિતરણ પર જાહેર નીતિની અસરને સમજવા અને તેનું વિશ્લેષણ કરવામાં તેમજ જાહેર ખર્ચ, કરવેરા, અંદાજપત્રીય પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. આ વિષયમાં જાહેર વસ્તુ અને સેવાઓ, ખાનગી વસ્તુ અને સેવાઓ, જાહેર આવકના સ્ત્રોતો, ખર્ચના સિદ્ધાંતો અને જાહેર દેવું સહિતના વિષયો નો સમાવેશ થાય છે.

કોર્સ આઉટકમ :

વિદ્યાર્થીઓ જાણકારી મેળવશે

1. જાહેર અર્થ વિધાનના વિષય વસ્તુ તેમજ વિવિધ પ્રકારની વસ્તુ.
2. જાહેર ખર્ચમાં ફેરફાર અને તેની અસરો.
3. જાહેર આવકના સ્ત્રોતો, કર અને તેની અસરો અને જાહેર દેવાની અસરો.

ભારાંક

એકમ-1: જાહેર વિત્તવ્યવસ્થા અને બજેટનો પરિચય

૨૫%

જાહેર વિત્તવ્યવસ્થાનો અર્થ- જાહેર અર્થવિધાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર - જાહેર વિત્તવ્યવસ્થાનું મહત્વ, જાહેર અર્થવિધાન અને ખાનગી અર્થવિધાન વચ્ચેનો તફાવત, અર્થ, લાક્ષણિકતાઓ અને જાહેર વસ્તુ અને ખાનગી વસ્તુ વચ્ચેનો તફાવત.

મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત અને તેની મર્યાદાઓ, મહત્તમ સમાજ કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ.

બજેટ (અર્થ, પ્રકાર, મહેસૂલી અને મૂડી બજેટ, મહેસૂલી અને મૂડી ખર્ચ) ખાધ (માત્ર ખ્યાલ) મહેસૂલી ખાધ, રાજકોષિય ખાધ, નાણાંકીય ખાધ, પ્રાથમિક ખાધ, શૂન્ય આધારીત બજેટ.

યુનિટ-2: જાહેર આવક

૨૫%

જાહેર આવક- પરિચય- અર્થ-સ્રોતો અને વર્ગીકરણ (કર અને બિન-કરવેરા સ્રોતોની આવક) – કરનો અર્થ અને પ્રકારો, પ્રત્યક્ષ અને પરોક્ષ કરના લાભાલાભ, કર આકારણીના સિદ્ધાંતો, આદર્શ કર વ્યવસ્થાના લક્ષણો -કરની અસરો- કરાઘાત, કરસંપાત અને કર વિવર્તન –કરદાન ક્ષમતા અને કરદાન ક્ષમતાને અસરકારતા પરિબલો – લેફર વક્રનો ખ્યાલ

GST નો પરિચય- GST ની વિગતો અને અસરો.

એકમ-3: જાહેર ખર્ચના સિદ્ધાંતો

૨૫%

પરિચય - અર્થ, જાહેર ખર્ચનાં હેતુઓ, મહત્વ - વર્ગીકરણ, જાહેર ખર્ચમાં વધારો થવાના કારણો - જાહેર ખર્ચના સિદ્ધાંતો- પીકોક અને વાઈસમેનનો સિદ્ધાંત, રાજ્યની પ્રવૃત્તિઓ વધારવાનો વેગનરનો નિયમ, જાહેર ખર્ચની અસરો

એકમ-4: જાહેર દેવું

૨૫%

જાહેર દેવાનો અર્થ, કારણો, જાહેર દેવાનું મહત્વ અને સ્રોત, જાહેર દેવાની ચૂકવણીની પદ્ધતિઓ- પ્રશિષ્ટ/રિકાર્ડિયન મંતવ્યો, કેઇન્સિયન અને પોસ્ટ- કેઇન્સિયન મંતવ્યો, જાહેર દેવાનો બોજ અને તેના પ્રકારો- આંતરિક અને બાહ્ય જાહેર દેવું, જાહેર દેવું અને ભાવિ પેઢી પર તેની અસરો. દેવાની ચૂકવણીની પદ્ધતિઓ, દેવાનું વ્યવસ્થાપન, જાહેર દેવું અને કરવેરા વચ્ચેની સરખામણી.

સંદર્ભ પુસ્તક:

1. મુસ્જોવ, આર.એ. અને પી.બી. મુસ્જોવ (1976), થિયરી અને પ્રેક્ટિસમાં પબ્લિક ફાઇનાન્સ,
2. આર. એ. મુસ્જોવ અને પી. બી. મુસ્જોવ (1989): થિયરી અને પ્રેક્ટિસમાં પબ્લિક ફાઇનાન્સ. મેકગ્રા હિલ
3. હ્યુટન, E. W. (Ed.) (1988), પબ્લિક ફાઇનાન્સ, પેગ્લેન, બાલ્ટીમોર.
4. મિઠાની, ડી.એમ. (1998), મોડર્ન પબ્લિક ફાઇનાન્સ, હિમાલયા પબ્લિશિંગ હાઉસ. મુંબઈ.
5. ઝા, આર. (1998), આધુનિક જાહેર અર્થશાસ્ત્ર, રૂટલેજ, લંડન.
6. જે. હિન્ડ્રિક્સ અને જી. માયલ્સ (2006): મધ્યવર્તી જાહેર અર્થશાસ્ત્ર.
7. ભાટિયા એચ એલ (2018): પબ્લિક ફાઇનાન્સ. વિકાસ પબ્લિશિંગ હાઉસ
8. કાર્લ સી. પ્લેન.: ઇન્ટ્રોડક્શન ટુ પબ્લિક ફાઇનાન્સ
9. ભારતમાં યુનિયન ફાઇનાન્સનો સિદ્ધાંત અને કાર્ય ભાર્ગવ આર. એન.
10. મિઠાણી ડી. એમ. મોડર્ન પબ્લિક ફાઇનાન્સ
11. એચ.એલ. ભાટિયા: પબ્લિક ફાઇનાન્સ
12. બી.પી. ત્યાગી: પબ્લિક ફાઇનાન્સ
13. આર.સી. અગ્રવાલ 30 પબ્લિક ફાઇનાન્સ.
14. પબ્લિક ફાઇનાન્સ: એસ. કે. સિંઘ
15. એમ. મારિયા જોન કેનેડી: પબ્લિક ફાઇનાન્સ.

VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY, SURAT.

BACHELOR OF ARTS

SEMESTER-4

SUBJECT: ECONOMICS

MAJOR PAPER- 8 : PUBLIC ECONOMICS

SYLLABUS

(Effective from 2024-25 as per NEP-2020)

Credit: 4

Objectives of the Course:

Public economics is the study of government policy from the points of view of economic efficiency and equity. The course will help in understanding and analyzing the impact of public policy on the allocation of resources and distribution of income in economy and also analysis of public expenditures, taxation, budgetary procedures. The subject encompasses a host of topics including public goods, private goods, sources of public revenue, theories of expenditure and public debt.

Course Outcomes:

1. The content in public finance as well as different types of goods.
2. The changes in public expenditure and its effects.
3. The sources of public revenue, taxes and its implications and effects of public debt.

Weightage

Unit-1: Introduction to Public Finance and Budget

25%

Meaning of Public Finance-Nature and Scope of Public Finance- Importance of Public Finance, Difference between public finance and private finance,

Meaning, characteristics and Difference between public goods and private goods.

Theory of maximum social welfare and its limitations, objective test of social welfare.

Budget (Meaning, Types, Revenue & Capital Budget, Revenue & Capital Expenditure) Deficit (Only Concept, Revenue Deficit, Fiscal Deficit, Monetized Deficit, Primary Deficit, Zero Budget based.

Unit-2: Public Revenue

25%

Introduction-Meaning-sources and classification public revenue (Tax and non-tax sources revenue) - Meaning and types of taxes, merits and demerits of direct and indirect taxes, theories of taxation, characteristics of good tax system, concept of impact of tax, ability pay - incidence of tax, Shifting Effects of Tax Burden and taxable capacity, factors affecting to taxable capacity and incidence of tax, effects of taxes, concept of Laffer curve.

Introduction of GST- Detail & effects of GST.

Unit-3: Theories of Public Expenditure

25%

Introduction – Meaning, Objective, importance of Public Expenditure - classifications, causes of increase public expenditure

Theories of public expenditure- Peacock and Wiseman's theory of public expenditure - Wagner's law of increasing state activities- effects of public expenditure,

Unit-4: Public Debt

25%

Meaning of Public **Debt**, causes, Importance and sources of public debt, payment

Methods of public debt- Classical/ Ricardian views, Keynesian and post-Keynesian views;

Burden of Public debt and types-burden of internal and external public debt, internal public debt and its effect on future generation, methods of debt redemption, debt management,

Comparison between public debt and taxation

Reference Book:

1. Musgrave, R. A. and P. B. Musgrave (1976), Public Finance in Theory and Practice,
2. R. A. Musgrave and P. B. Musgrave (1989): Public Finance in Theory and Practices. McGraw Hill
3. Houghton, E. W. (Ed.) (1988), Public Finance, Penguin, Baltimore.
4. Mithani, D. M. (1998), Modern Public Finance, Himalaya Publishing House. Mumbai.
5. Jha, R. (1998), Modern Public Economics, Routledge, London.
6. J. Hindriks and G. Myles (2006): Intermediate Public Economics.
7. Bhatia H L (2018): Public Finance. Vikas Publishing House.
8. Carl C. Plehn.: Introduction to public finance
9. The theory & working of Union finance in India Bhargava R. N.
10. Mithani D. M. Modern Public Finance
11. H. L. Bhatia: Public Finance
12. B. P. Tyagi: Public Finance
13. R. C. Agrawal 30 Public Finance.
14. Public Finance: S. K. Singh
15. M. Maria John Kennedy: Public Finance.

